

## ૨૮ ઓગાષ્ટ -૨૦૧૬ (રવિવાર)

**(૧) નેશનલ સ્પોર્ટ્સ કે :**

- ભારતના પૂર્વ હોકીના મહાન ખેલાડી અને જાહુગારનું બિર્ડ મેળવનાર મેજર દ્યાનયંદજુના માનમાં આ દિવસ ઉજવાય છે.
- તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૯૦૫ના રોજ ઉત્તરપ્રેદ્દેશના અલહાબાદ જિલ્લાના પ્રચાગ ગામે થયો હતો.
- માત્ર ૧૭ વર્ષની વધે તેઓ લશ્કરમાં ભરતી થએ ગયા હતા.
- લશ્કરમાં હોકીની રમત લોક્ઝીય હોય તેઓએ ૧૯૨૩ થી લશ્કર વઠી હોકી રમવાનું શરૂ કર્યું હતું.
- ઓલિમ્પિક રમતોસ્થાપ, ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ એમ સંંગ ગ્રાના - ગ્રાના વખત હોકીની રમતમાં ગોલ્ડમેડલ મેળવી ભારતને સંભાન આપાવ્યું હતું.
- દ્યાનયંદજુએ ર૩ વર્ષ સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ નિવૃતી જાહેર કરી હતી.
- વર્ષ ૧૯૮૫માં ભારત સરકારે રમતગમત દ્વારે આમૂલ્ય યોગદાન બદલ પદ્ધતિ પુરુષકારથી તેમનું સંભાન કર્યું હતું.
- અવસાન : ૩ ડિસેમ્બર, ૧૯૭૯
- તેમનો જન્મ દિવસે રમતગમતના ભારતનું ગૌરવ વધારનારા ખેલાડીઓ તેમજ કોથને એવોડ્સ આપીને તેમનું સંભાન કરવામાં આવે છે.

- (૨) ઇસરોએ સ્કેમજેટ એન્જિનનું સફળ પરિક્ષણ કર્યું :**
- તાજેતરમાં જ ઇસરોએ વાતાવરણમાંથી જ ઓક્સિજન શોખીને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા સ્કેમજેટ એન્જિનનું સફળ પરિક્ષણ કર્યું.
  - આ એન્જિનને આંધ્રાના શ્રીહિન્કિરોટા સતિશ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
  - આ પરિક્ષણ સાથે જ ભારત અમેરિકાની નાસા એજન્ઝિની બરોબર આવી ગયું છે.
  - સ્કેમજેટ એન્જિનનું વજન : ૩૨૭૭ કિ.ગ્રા.
  - આ સ્કેમજેટ એન્જિન થિર્યાનન્થપુરમના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે તૈયાર થયું છે.
  - સ્કેમજેટ એન્જિન રોકેટમાં ઉપયોગમાં લેવાતા એન્જિનની તુલનામાં હણવું વજન ધરાવે છે.
  - તેના ઉપયોગને કારણે રોકેટનું વજન લગભગ અડધું થએ જાય છે, વજન હલકું થતાં સ્પેસમાં ભારે પેલોડ લદ જવામાં મદદ મળશે.
  - આ એન્જિનનો ઉપયોગ થતાં લોન્ચિંગ ખર્ચ ઘટશે.

**સ્કેમજેટ એન્જિન કઈ રીતે કામ કરે છે ? :**

- રાખેતા મુજબના રોકેટ એન્જિન ઇંદ્ઘાળ અને ઓક્સિડાઇગર બંનેનું વહન કરતા હોય છે.
- પરંતુ સ્કેમજેટ એન્જિન બ્રિથિંગ સિસ્ટમ ધરાવે છે કે જે રોકેટ સુપરસોનિક સ્પીડમાં હોય ત્યારે વાતાવરણમાના ઓક્સિજનનો કાંપ્રેસ કરે છે.
- વાતાવરણમાં રહેલો પ્રાણવાયુ જ ઓક્સિડાઇગર તરીકે ઉપયોગમાં આવીને લિક્વિડ હાઇડ્રોજન જેવા ઇંદ્ઘણને બળવામાં મદદ કરે છે.

**(૩) કનેક્ટિક્ટ ઓપન - ટેનિસ :**

- ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ મહિલા ડબલ્સમાં બીજા સતત બીજું ટાઇટલ જીત્યું.
  - વિજેતા જોડી : સાનિયા મિર્જા (ભારત)
- અને મોનિકા નિફલેસ્ક

**(૪) વિશ્વના વધુ વથના વૃદ્ધિ :**

- તાજેતરમાં ઇન્ડોનેશિયના જાવાના શ્રોજન ગામે વિશ્વની સૌથી વધુ વથ ધરાવનાર વૃદ્ધ એમ્બાઈ ગોથાએ તેમની ઉમર ૧૪૫ વર્ષ હોવાનું જણાવ્યું.
- એક બ્રિટિશ અખબાર પ્રમાણે આ વ્યક્તિની જન્મ તારીખ

સ્થાનિક રેકર્ડ મુજબ સાચી છે.

- ગોથાનો જન્મ ૩૧ ડિસેમ્બર, ૧૮૭૦ના રોજ થયો હતો.
- પ્રશ્નો :
- (૧) બાળમજુચી અંગેની ફસ્ટિયાદ નોંધાવા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ?
- ૧૦૮૮
- (૨) રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય છે ?
- ૨૮ ઓગસ્ટ
- (૩) કયાં મહાન ખેલાડીના માનમાં રાષ્ટ્રીય રમત દિવસ ઉજવાય છે ?
- મેજર દ્યાનયંદજુ
- (૪) દ્યાનયંદજુના નેતૃત્વ હેઠળ ભારતે ઓલિમ્પિકમાં હોકીમાં કેટલા ગોલ મેળવ્યા ?
- ગ્રાના
- (૫) કયાં વર્ષમાં ભારત સરકાર દ્વારા મેજર દ્યાનયંદજુને પદ્મભૂષણી નવાજવામાં આવ્યા હતા ?
- ૧૯૮૬
- (૬) તાજેતરમાં ઇસરોએ કયાં એન્જિનનું સફળ પરિક્ષણ કર્યું જે વાતાવરણમાંથી પ્રાણવાયુ શોષી શકે છે ?
- સ્કેમજેટ એન્જિન
- (૭) વિશ્વના સૌથી વધુ વથ ધરાવનાર એમ્બાઈ ગોથા કયા દેશના છે ?
- ઇન્ડોનેશિયા
- (૮) સ્કેમજેટ એન્જિનનું લોન્ચિંગ કયાંથી કરાયું હતું ?
- શ્રી હિન્કિરોટા રિથેટ સાતિષ ધવન સ્પેસ સેન્ટર
- (૯) સ્કેમજેટ એન્જિન કયાં તૈયાર થયું હતું ?
- વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, થિર્યાનન્થપુરમાં